



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૩૧/૦૫/૨૦૧૯ શુક્રવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૯૨૮/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૭૦ કેસ કરી, ૬૪ વ્યક્તિઓને ઝડપી, ૨૧૬ લીટર દેશી દારૂ, ૪૭૬ બોટલ ઈંગ્લીશ દારૂ, ૪૩૨ ક્વાર્ટર ઈંગ્લીશ દારૂ, ૧૯૨ બિયર ટીન અને ૧ કાર કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૩ કેસ કરી ૭ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૧૪,૭૬૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૯૨૯/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૯૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પાસા હેઠળ ૬ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

છેતરપીંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૯૩૦/૧૯

વટવા: પીનાકીનકુમાર વિશ્વલભાઈ પટેલ (રહે. ગોકુલપુરા પટેલ વાસ ગામ-ટુણાદરા તા-માલપુર જી-અરવલ્લી) એ તા.૩૦/૦૫/૧૯ નારોજ વટવા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે પીનાકીનકુમાર પટેલે ભાડેથી ગાડીઓ રાખતા આરોપી (૧) ધનંજયભાઈ ઉર્ફે ધનશ્યામભાઈ ચીનુભાઈ સોની (રહે. સાર્થક ટેનામેન્ટ ઘોડાસર (૨) મીતેષભાઈ પ્રજાપતિ અને (૩) ધનજયભાઈના જમાઈ મુકેશભાઈ પટેલ (જેના પુરા નામઠામની ખબર નથી) નાઓને દર મહિને રૂપિયા ૨૨૦૦૦/- નક્કી કરી ૧૦૦ ના સ્ટેમ્પ પર ભાડેથી આપવાનું લખાણ કરી તા.૨૫/૦૩/૧૯ નારોજ પોતાની અમેઝ ફોર વ્હીલ ગાડી નંબર જીજે.૩૧ ટી ૧૭૧૬ કિમત રૂપિયા ૮,૦૦,૦૦૦/- ગાડી ભાડે આપી હતી. જે ગાડીનું આજદીન સુધી ભાડું નહીં આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી ગાડી લઈ ત્રણેય ભાગી ગયા છે. તેમજ ટેક્સી ડ્રાઇવર ગુપના ગોવિંદભાઈ ચાવલાની ટાટા ઇન્ડીકો ગાડી નંબર જીજે ૦૧ ડીએક્ષ ૫૩૨૮, દિનેશભાઈ ચંદેલની સ્વીફ્ટ ડીઝાઇર ગાડી નંબર જીજે ૦૧ બીએડ ૮૩૮૪, પાર્થ જાદવની હોન્ડા એક્સેન્ટ ગાડી નંબર જીજે ૦૧ ઇટી ૯૪૯૬, દેવેન્દ્રભાઈ મેસવાણીયાની ટાટા જેસ્ટ ગાડી નંબર જીજે ૧૧ ટીટી ૬૪૬૫, અને જયંતિભાઈ પરમારની ઇયોએન ફોર ગાડી નંબર જીજે ૧૮ એએડ ૩૧૭૬ તેમજ અન્ય બીજા વ્યક્તિઓની પણ ગાડીઓનું આ રીતે ભાડાનું લખાણ કરી વિશ્વાસમા લઈ કચાંક ભાગી ગયા છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી જે.વાય.ચૌહાણ ચલાવે છે.

કૃષ્ણનગર: મેહુલ પ્રવિણચંદ્ર પ્રજાપતિ (રહે.અંબાલાલ પાર્ક સોસાયટી ઉમા હોસ્પિટલ પાસે કૃષ્ણનગર) એ તા.૩૦/૦૫/૧૯ નારોજ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે માહે સપ્ટેમ્બર-૨૦૧૮ થી આજદીન સુધીના સમયગાળા દરમ્યાન મેહુલ પ્રજાપતિએ ડામરની ખરીદી માટે આરોપી “કાસ્ન “ નામે કંપની ધરાવતા બીટુનીમ એટલે કે ડામરના હોલસેલના વેપારી મનિષભાઈ ભુપતરાય મહેતા (રહે. બી વીગ બી/બી/૧૧૦૨ ઓબેરોય સ્કાય હાઈટ્સ સી.એચ.એસ.લીમીટેડ ૧૨૦ વાઈડ રોડ લોખંડવાલા કોમ્પ્લેક્ષ અંધેરી વેસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર) ના ખાતામાં માલના નાણાં ભર્યા હતા. જે પૈકી બીટુનીમ એટલે કે ડામરનો માલ રૂપિયા ૩૮,૧૪,૦૦૦/- નહી મોકલી કે નાણાં પરત નહી આપી છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી મારી નાખવાની ધમકી આપી હતી. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એ.આર.વાઘેલા ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૯૩૧/૧૯

ખોખરા: ચંદ્રદેવસિંહ મિત્તનસિંહ રાજપુત (રહે. આર્યવ્રત સોસાયટી મણીનગર પુર્વ) એ તા.૩૦/૦૫/૧૯ નારોજ ખોખરા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૬/૦૫/૧૯ રાતના ૯/૦૦ થી તા.૨૭/૦૫/૧૯ સવારના ૬/૦૦ વાગ્યા દરમ્યાન હાટકેશ્વર ચાર રસ્તા પાસે આવેલ જૈન મંદિરની બાજુમાં આવેલ શનિદેવના મંદિરની તિજોરીમાંથી ચાંદીના છત્ર નંગ-૪ કિમત રૂપિયા ૪૦,૦૦૦/- અને પંચ ધાતુનું ચક્ર કિમત રૂપિયા ૨૦૦૦/- અને રોકડ રૂપિયા ૫૦૦/- અજાણી વ્યક્તિ ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી ડી.કે.ચૌધરી ચલાવે છે.

વાહન ચોરી:-

સમાચાર યાદી નં.૯૩૨/૧૯

અમરાઈવાડી: મનોજ રામગ્યાની દિવાકર (રહે. ગુજરાત હાઉસીંગ બોર્ડ ખોખરા) એ તા.૩૦/૫/૧૯ નારોજ અમરાઈવાડી પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૮/૫/૧૯ સાજના ૫/૦૦ વાગે અમરાઈવાડી અશોકનગરના મુખ્ય દરવાજાની બાજુમા પાર્ક કરેલ ડમ્પર ગાડી નંબર જીજે ૨૭ યુ ૯૯૯૯ કિમત રૂપિયા ૭,૦૦,૦૦૦/- અજાણી વ્યક્તિ ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી ડી.એસ મકવાણા ચલાવે છે.

વાહન અકસ્માતમાં મૃત્યુ:-

સમાચાર યાદી નં.૯૩૩/૧૯

“એમ” ડીવીજન ટ્રાફિક પોલીસ સ્ટેશન: તરૂબહેન વા/ઓ રમેશભાઈ પરીખ (ઉ.વ.૭૪) (રહે.દેવ દર્શન ટાવર માણેકબાગ) તા.૨૯/૫/૧૯ સાજના ૬/૧૫ વાગ્યાના સુમારે માણેકબાગ ચાર રસ્તાથી નહેરૂનગર બી.આર.ટી.એસ.બસ સ્ટેન્ડ નજીક દર્શક ઈલેક્ટ્રોનિક નામની દુકાન નજીકથી ચાલતા પસાર થઈ રહ્યા હતા. ત્યારે બીઆરટીએસ બસના ચાલકે બસ પુરઝડપે અને બેદરકારીથી ચલાવી તક્કર મારતા ગંભીર ઈજાઓ થતા તરૂબહેનનું મૃત્યુ નિપજયું હતું. આ અંગેની ફરીયાદ નીતાબહેન બાબુલાલ પરીખે “એમ” ડીવીજન ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ ઈ.પો.સ.ઈ.શ્રી ડી.એ.આઈ.શેખ ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૯૩૪/૧૯

ગોમતીપુર: યોગેશકુમાર ગીરીશભાઈ મકવાણા (ઉ.વ.૨૩) (રહે. પટેલ પરમાનંદની ચાલી ગોમતીપુર) એ અગમ્ય કારણસર તા.૨૪/૦૫/૧૯ રાતના ૯/૦૦ વાગ્યાના સુમારે ગોમતીપુર પટેલ પરમાનંદની ચાલીના પાછળ ભાગે આવેલ ખુલ્લા મેદાનમાં સળગી ગયા હતા. સારવાર માટે તેમને શારદાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે ગોમતીપુર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી નરેન્દ્રભાઈ ભીખાભાઈ ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.